

## ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

### અગત્યની જાહેરાત

મંડળ ધ્વારા તાંત્રિક/બિન તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટે તા. ૨૫/૦૭/૨૦૧૯ ના રોજ જાહેરાત ક્રમાંક: ૧૫૨/૨૦૧૮૧૯ થી ૧૬૬/૨૦૧૮૧૯ તેમજ તા. ૨૦/૦૭/૨૦૧૯ ના રોજ જા.ક. ૧૮૩/૨૦૧૨૦ પ્રસિધ્ધ કરી ઓન-લાઇન અરજી પત્રકો મેળવવામાં આવેલ છે. જે પૈકીની નીચે દર્શાવેલ જાહેરાતોના સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટીને અંતે બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફીસિયન્સી ટેસ્ટ માટે લાયક (ફવોલીફાય) ઠરેલ ઉમેદવારોની યાદી તથા અભ્યાસક્રમ અને અગત્યની સુચના તથા પરીક્ષાની તારીખ તા. ૨૬/૧૧/૨૦૨૦ ના રોજ મંડળની વેરસાઇટ પર મુકવામાં આવેલ છે. જે સંવર્ગોની બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફીસિયન્સી ટેસ્ટ ગાંધીનગર ખાતે યોજાનાર છે. જે સંદર્ભે ઉક્ત દરેક સંવર્ગોની પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો કાર્યક્રમ નીચે દર્શાવ્યા પ્રમાણેનો મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી.

અનિવાર્ય કારણોસર મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે.

અ. નં.	જાહેરાત ક્રમાંક / સંવર્ગનું નામ	પરીક્ષાની તારીખ/ સમય	કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખ- સમયની વિગતો
૧	૧૮૩/૨૦૧૯૨૦- પ્રોબેશન ઓફિસર	૨૨/૧૨/૨૦૨૦ ૧૨-૦૦ થી ૧૩-૧૫	તા. ૧૪/૧૨/૨૦૨૦, બપોરે ૧૪-૦૦ કલાકથી તા. ૨૨/૧૨/૨૦૨૦, બપોરે ૧૨-૦૦ કલાક સુધી
૨	૧૫૬/૨૦૧૯૧૯- આસીસ્ટન્ટ ફાર્માસીસ્ટ (આયુર્વેદ)	૨૨/૧૨/૨૦૨૦ ૧૨-૦૦ થી ૧૩-૧૫	તા. ૧૪/૧૨/૨૦૨૦, બપોરે ૧૪-૦૦ કલાકથી તા. ૨૨/૧૨/૨૦૨૦, બપોરે ૧૨-૦૦ કલાક સુધી
૩	૧૬૨/૨૦૧૯૧૯- આસીસ્ટન્ટ બાઇન્ડર	૨૨/૧૨/૨૦૨૦ ૧૨-૦૦ થી ૧૩-૦૦	તા. ૧૪/૧૨/૨૦૨૦, બપોરે ૧૪-૦૦ કલાકથી તા. ૨૨/૧૨/૨૦૨૦, બપોરે ૧૨-૦૦ કલાક સુધી
૪	૧૬૩/૨૦૧૯૧૯- આસીસ્ટન્ટ મશીનમેન	૨૨/૧૨/૨૦૨૦ ૧૫-૦૦ થી ૧૬-૦૦	તા. ૧૪/૧૨/૨૦૨૦, બપોરે ૧૪-૦૦ કલાકથી તા. ૨૨/૧૨/૨૦૨૦, બપોરે ૧૫-૦૦ કલાક સુધી
૫	૧૬૫/૨૦૧૯૧૯- સબ ઓવરશીયર	૨૨/૧૨/૨૦૨૦ ૧૫-૦૦ થી ૧૬-૦૦	તા. ૧૪/૧૨/૨૦૨૦, બપોરે ૧૪-૦૦ કલાકથી તા. ૨૨/૧૨/૨૦૨૦, બપોરે ૧૫-૦૦ કલાક સુધી

ઉમેદવારોએ જે તે સંવર્ગની બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટેના કોલ લેટર તથા તે સાથેની જરૂરી સુચનાઓ સહિત ઉપર દર્શાવેલ નિયત તારીખ-સમયગાળા દરમ્યાન “<https://ojas.gujarat.gov.in>” વેબસાઇટ પરથી અચૂક (ON LINE) ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

પ્રવેશપત્ર “ON LINE” ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં (૧) “<https://ojas.gujarat.gov.in>” વેબસાઇટ પર જવું. (૨) બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટેના ઉમેદવારોએ “Call Letter” પર “Click” કરવું (૩) ત્યાર બાદ “Secondary/Main Exam Call letter” પર “Click” કરીને Select Job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલ લેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં “Confirmation Number” તથા “Birth Date” ટાઇપ કરીને OK પર Click કરવાથી અલગ Window માં આપનો Call letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે. જે Call Letter તથા તે સાથેની સુચનાઓની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. ( કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે.

ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ કોલ-લેટર તથા સુચનાઓની વિગતો કે જે કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ સમયે હાજરી પત્રકની વિગતો ભરવા તેમજ પરીક્ષાની આગળની કાર્યવાહી માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક વાંચી જવી. ઓન-લાઇન કોલ લેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઇ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના નાયબ સચિવશ્રી (તાંત્રિક પરીક્ષા) નો કચેરી સમય દરમ્યાન ફોન નં. ૦૭૯- ૨૩૨૫૩૬૨૮ પર સંપર્ક કરી શકાશે.


ઉમેદવારોએ ઉપર મુજબની સુચનાઓ ઉપરાંત કોવિડ-૧૯ અન્વયેની નીચે મુજબની સુચનાઓ પણ ધ્યાને લેવાની રહેશે.

- (૧) દરેક પરીક્ષાર્થીઓએ મોં પર માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. તેમજ સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું રહેશે.
- (૨) પરીક્ષામાં ભાગ લેનારા તમામ પરીક્ષાર્થીઓ તેમજ કર્મચારી/અધિકારીશ્રીઓનું ટેમ્પરેચર, ટેમ્પરેચર ગન દ્વારા માપવાનું રહેશે.
- (૩) તમામ પરીક્ષાર્થીઓ તેમજ તેમજ કર્મચારી/અધિકારીશ્રીઓને હાથ ઉપર સેનેટાઇઝ સ્પ્રે લગાડીને પ્રવેશ આપવામાં આવશે.

- (૪) તમામ પરીક્ષાર્થીઓ પીવાના પાણીની બોટલ જાતે જ સાથે લાવવી હિતાવહ છે.
- (૫) પરીક્ષા સ્થળ તેમજ કેમ્પસમાં પરીક્ષાર્થી સિવાય તેઓના સગા/ સબંધીઓને પ્રવેશવા દેવામાં આવશે નહીં.
- (૬) કોવિડ- ૧૯ અંતર્ગત કેન્દ્ર / રાજ્ય સરકારશ્રી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલ સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

સ્થળ: ગાંધીનગર

તારીખ: ૧૪/૧૨/૨૦૨૦



સચિવ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ  
ગાંધીનગર